



DCW-190304

Seat No. _____

LL.B. (Sem. III) (W.E.F. 2019) Examination

August - 2022

Principles of Taxation Laws

Time : 3.00 Hours]

[Total Marks : 100

- સૂચના : (1) દરેક પ્રશ્નનાં ગુણ સરખા છે.
 (2) દરેક પ્રશ્નનાં ઉત્તર આપો.
 (3) પ્રશ્નપત્રનો સમય 3 (ત્રણ) કલાકનો રહેશે.

- | | | |
|---|--|----|
| 1 | મકાન મિલકતની આવકની ગણતરીમાં બાદ મળતા ખર્ચાઓ વર્ણવો. | 20 |
| | અથવા | |
| 1 | આવકવેરા કાયદા હેઠળ ધંધા-વ્યવસાયની આવકમાંથી બાદ મળતા ખર્ચાઓ વર્ણવો. | 20 |
| 2 | કુલ આવકની ગણતરીમાંથી પ્રાપ્ત થતી કપાતો જણાવો. | 20 |
| | અથવા | |
| 2 | આવકવેરા કાયદા નીચે મૂકીનફાની જોગવાઈઓ વર્ણવો. | 20 |
| 3 | વ્યક્તિગત રહેઠાણના દરજ્જાની આવકવેરા કાયદા નીચે ચર્ચા કરો. | 20 |
| | અથવા | |
| 3 | પગારની આવકમાં કઈ કઈ આવકનો સમાવેશ થાય છે અને બાદ મળે છે. | 20 |
| 4 | GSTના કાયદા હેઠળ ITC (ઈનપુટ ટેક્સ ક્રેડિટ)ની ચર્ચા કરો. | 20 |
| | અથવા | |
| 4 | GSTના કાયદા હેઠળ રજિસ્ટ્રેશનની ચર્ચા કરો. | 20 |
| 5 | ટૂંક નોંધ લખો : (ગમે તે બે) | 20 |
| | (1) GST કાઉન્સિલ (GST) | |
| | (2) સ્થળ પર માલનો સપ્લાય (GST) | |
| | (3) કરદાતા આવકવેરા સંદર્ભે (IT) | |
| | (4) આવક (IT) | |

ENGLISH VERSION

- Instructions :** (1) All questions carry equal marks.
(2) Attempt all questions.
(3) The time of question paper will be **3 (Three)** hours.

- 1** Describe the permissible deductions (expenses) under the Income from House property. **20**

OR

- 1** Describe the permissible deductions of income from Business professions under the Income Tax Act. **20**

- 2** Explain the deductions available from the computation of total income. **20**

OR

- 2** Explain the provisions related to 'capital gains' under the Income Tax Act. **20**

- 3** Discuss the residential status of person under the Income-Tax Act. **20**

OR

- 3** Which Incomes are included and excluded from Income of salary ? **20**

- 4** Discuss the ITC (Input Tax Credit) under the GST Act. **20**

OR

- 4** Discuss registration under the GST Act. **20**

- 5** Write short notes : (any **two**) **20**

- (1) GST Council (GST)
- (2) The place of supply of goods (GST)
- (3) Assessee (IT)
- (4) Income (IT)